



தமிழ்நாடு போலீஸ்
தலைநகர்

தமிழ்நாடு போலீஸ் தலைநகர் தலைநகர் தலைநகர்
தலைநகர்

தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர்

171-M(F2))/TUL/2023/036

09 ஜூன் 2023

தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர்

PC-171/2023/W001

தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர்
தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர்
தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர் தலைநகர்

Catering Services for Staffs and Arrestees at
Ga.Vilingili Police Station

ሚሲዮን የፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና

<p>የሥራ ማረጋገጫ ስልጠና ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና.</p>	
<p>ሚሲዮን የሥራ ማረጋገጫ</p>	2.0
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና. የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና.</p> <p>ግልጽ የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና.</p>	2.1
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና " Bid Registration Form " ስልጠና ስልጠና.</p>	2.2
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና ስልጠና ስልጠና ስልጠና.</p>	2.3
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና ስልጠና ስልጠና ስልጠና ስልጠና.</p>	2.4
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና ስልጠና ስልጠና ስልጠና ስልጠና.</p>	2.5
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና ስልጠና ስልጠና ስልጠና.</p>	2.6
<p>የሥራ ማረጋገጫ ስልጠና ለፊት ለፊት የሥራ ማረጋገጫ ስልጠና ስልጠና ስልጠና ስልጠና ስልጠና.</p>	2.7

חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה

<p>4.2</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p> <ul style="list-style-type: none"> • חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה • חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה • חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה 	<p>4.2</p>
<p>4.3</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	<p>4.3</p>
<p>חוקי התורה והמצוות</p>	
<p>5.1</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	<p>5.1</p>
<p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	
<p>5.3</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	<p>5.3</p>
<p>חוקי התורה והמצוות</p>	
<p>6.1</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	<p>6.1</p>
<p>6.2</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	<p>6.2</p>
<p>6.3</p> <p>חוקי התורה והמצוות, חוקי התורה, חוקי התורה, חוקי התורה</p>	<p>6.3</p>

የደንበኞች ጉዳዮች ለመፍታት የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል

<p>ጋ 17.3 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል "የገቢዎች ስርዓት" ጋ 17.3 ንድፍ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17.3 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	<p>15.4</p>
<p>ጋ 17.1 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17.1 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	<p>15.5</p>
<p>17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል 13-K/CIR/2018/01 ጋ 17 ንድፍ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	<p>15.6</p>
<p>17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል 13-K/CIR/2018/01 ጋ 18 ንድፍ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል PR-14</p>	<p>15.7</p>
<p>17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል 14 (አምስት) ንድፍ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል 13-K/CIR/2018/01 ጋ 19 ንድፍ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል PR-15</p>	<p>15.8</p>
<p>17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17-09 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	<p>15.9</p>
<p>ጋ 16.0 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	
<p>17.11 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 17.11 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል 13-K/CIR/2018/01 ጋ 21 ንድፍ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል PR-16</p>	<p>16.1</p>
<p>ጋ 17.0 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	
<p>10.33 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል ጋ 10.33 ደንብ ለማሳደግ የሚያስፈልጉ ጥያቄዎችን ያመለክታል</p>	<p>17.1</p>

מַחְזָקִים וְדַבָּרֵי נִמְרָטִים, מַחְזָקִים, מַחְזָקִים עַד כְּרוֹחוֹתָם, אֲרוֹמֵסוּן

<p>17.2 קִינָה וְדַבָּרֵי נִמְרָטִים 10-33 אֲרוֹמֵסוּן עַד כְּרוֹחוֹתָם מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן וְיִנְיָנוּן אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ נִמְרָטִים וְיִנְיָנוּן.</p>	<p>17.2</p>
<p>17.3 מַחְזָקִים נִמְרָטִים וְיִנְיָנוּן, מִלְּפָנֶיךָ נִמְרָטִים, דַּבָּרֵיךָ מִלְּפָנֶיךָ מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן דַּבָּרֵיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן נִמְרָטִים וְיִנְיָנוּן. דַּבָּרֵיךָ נִמְרָטִים וְיִנְיָנוּן אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן.</p>	<p>17.3</p>
<p>17.4 מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן.</p>	<p>17.4</p>
<p>17.5 מַחְזָקִים מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן מִלְּפָנֶיךָ אֲרוֹמֵסוּן.</p>	<p>17.5</p>

መደብ 2 - የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)

ጥያቄ - 2 (የጥያቄ ማረጋገጫ ሰነድ)

1. የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
7.1	የጥያቄ ማረጋገጫ ሰነድ	1.2	የጥያቄ ማረጋገጫ ሰነድ
1.3	የጥያቄ ማረጋገጫ ሰነድ	1.4	የጥያቄ ማረጋገጫ ሰነድ
2. የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
2.1	የጥያቄ ማረጋገጫ ሰነድ		
2.2	የጥያቄ ማረጋገጫ ሰነድ		
2.3	የጥያቄ ማረጋገጫ ሰነድ	2.4	የጥያቄ ማረጋገጫ ሰነድ
2.5	የጥያቄ ማረጋገጫ ሰነድ		
2.6	የጥያቄ ማረጋገጫ ሰነድ		
2.7	የጥያቄ ማረጋገጫ ሰነድ		
2.8	የጥያቄ ማረጋገጫ ሰነድ		
3. የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
2.1	የጥያቄ ማረጋገጫ ሰነድ		የጥያቄ ማረጋገጫ ሰነድ
2.2	የጥያቄ ማረጋገጫ ሰነድ		171-M(F2)/IUL/2023/036
4. የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
4.1	የጥያቄ ማረጋገጫ ሰነድ		የጥያቄ ማረጋገጫ ሰነድ
4.2	የጥያቄ ማረጋገጫ ሰነድ		የጥያቄ ማረጋገጫ ሰነድ
4.3	የጥያቄ ማረጋገጫ ሰነድ		የጥያቄ ማረጋገጫ ሰነድ
5. የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			
5.1	የጥያቄ ማረጋገጫ ሰነድ		የጥያቄ ማረጋገጫ ሰነድ
5.2	የጥያቄ ማረጋገጫ ሰነድ		የጥያቄ ማረጋገጫ ሰነድ
6. የጥያቄ ማረጋገጫ ሰነድ (የጥያቄ ማረጋገጫ ሰነድ)			

መዘናኛ ልማት ስራዎች ለማስፈጸም የሚያስፈልጉ ስራዎች ለማድረግ

<p>ገንዘብ ስራዎች ለማስፈጸም የሚያስፈልጉ ስራዎች ለማድረግ</p>	
9.1	ሰነድ / መረጃ
9.1.1	1 ሰነድ
	ገንዘብ ስራዎች
	ሰነድ / ሰነድ ለማስፈጸም
	ገንዘብ ስራዎች ለማስፈጸም
	ገንዘብ ስራዎች
9.1.2	2 ሰነድ
	ገንዘብ ስራዎች
	ሰነድ / ሰነድ ለማስፈጸም
	ገንዘብ ስራዎች ለማስፈጸም
	ገንዘብ ስራዎች
9.2	ቅጂ
9.2.1	1 ቅጂ
	ገንዘብ ስራዎች
	ሰነድ / ሰነድ ለማስፈጸም
	ገንዘብ ስራዎች ለማስፈጸም
	ገንዘብ ስራዎች
9.2.2	2 ቅጂ
	ገንዘብ ስራዎች
	ሰነድ / ሰነድ ለማስፈጸም
	ገንዘብ ስራዎች ለማስፈጸም
	ገንዘብ ስራዎች
9.3	የሰነድ ሰነድ
	ገንዘብ ስራዎች
	ሰነድ / ሰነድ ለማስፈጸም
	ገንዘብ ስራዎች ለማስፈጸም
	ገንዘብ ስራዎች
10. የሰነድ ሰነድ ለማስፈጸም	
10.1	ገንዘብ ስራዎች ለማስፈጸም የሚያስፈልጉ ስራዎች ለማድረግ
10.2	ገንዘብ ስራዎች ለማስፈጸም የሚያስፈልጉ ስራዎች ለማድረግ

Form of Bid Security (Bank Guarantee)

WHEREAS,[name of Bidder] (hereinafter called "the Bidder") has submitted his Bid for the Project no.....issued by the Ministry of Communication, Science & Technology onfor construction of[name of Contract] (hereinafter called "the Bid").

KNOW ALL PEOPLE by these presents that We [name of Bank] of [name of country] having our registered office at (hereinafter called "the Bank") are bound unto[name of Purchaser] (hereinafter called "the Purchaser") in the sum of *..... for which payment well and truly to be made to the said Purchaser, the Bank binds itself, its successors, and assigns by these presents.

SEALED with the Common Seal of the said Bank thisday of20.....

THE CONDITIONS of this obligation are:

- (1) If, after Bid opening, the Bidder withdraws his Bid during the period of Bid validity specified in the Form of Bid;
- or
- (2) If the Bidder having been notified of the acceptance of his Bid by the Purchaser during the period of Bid validity:
 - (a) fails or refuses to execute the Form of Agreement in accordance with the Instructions to Bidders, if required; or
 - (b) fails or refuses to furnish the Performance Security, in accordance with the Instruction to Bidders; or
 - (c) does not accept the correction of the Bid Price pursuant to Clause 27,

* The Bidder should insert the amount of the Guarantee in words and figures denominated in Maldivian Rufiyaa. This figure should be the same as shown in Clause 16.1 of the Instructions to Bidders.

we undertake to pay to the Purchaser up to the above amount upon receipt of his first written demand, without the Purchaser's having to substantiate his demand, provided that in his demand the Purchaser will note that the amount claimed by him is due to him owing to the occurrence of one or any of the three conditions, specifying the occurred condition or conditions.

This Guarantee will remain in force up to and including the date days after the deadline for submission of bids as such deadline is stated in the Instructions to Bidders or as it may be extended by the Purchaser, notice of which extension(s) to the Bank is hereby waived. Any demand in respect of this Guarantee should reach the Bank not later than the above date.

DATE..... SIGNATURE OF THE BANK

Form of Performance Bank Guarantee (Unconditional)

To:
[name & address of Purchaser]
.....

WHEREAS [name and address of Supplier] (hereinafter called "the Supplier") has undertaken, in pursuance of Contract No. dated to execute [name of Contract and brief description of Works] (hereinafter called "the Contract");

AND WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank Guarantee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in accordance with the Contract;

AND WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee;

NOW THEREFORE we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, up to a total of *..... [amount of Guarantee] [amount in words], such sum being payable in the types and proportions of currencies in which the Contract Price is payable, and we undertake to pay you, upon your first written demand and without cavil or argument, any sum or sums within the limits of [amount of Guarantee] as aforesaid without your needing to prove or to show grounds or reasons for your demand for the sum specified therein.

*An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price specified in the Contract, in Maldivian Rufiyaa.

We hereby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the demand.

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works to be performed there under or of any of the Contract documents which may be made between you and the Supplier shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification.

This Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate.

SIGNATURE AND SEAL OF THE GUARANTOR

Name of Bank

Address

Date

מְשֻׁבָּה לְפָנֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ

❖ וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ

❖ וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ
עַל אֲשֶׁר עָשִׂינוּ לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ

❖ וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ
עַל אֲשֶׁר עָשִׂינוּ לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ

❖ וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ
עַל אֲשֶׁר עָשִׂינוּ לְפָנֶיךָ יְיָ אֱלֹהֵינוּ, וְנִשְׁכַּח עֲוֹנוֹתֵינוּ

መደብ ወይንም ሌሎችም ሲሆኑ ለባለቤቱ ለውጤት ማግኘት ማግኘት ይገባል።

ገንዘብ - 6 (ገንዘብ ክፍያ)

ከገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል።

1 ለገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል።

- (ሀ) ገንዘብ ሰነድ
- (ለ) ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል
- (ሐ) ገንዘብ ሰነድ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል
- (መ) ገንዘብ ሰነድ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል
- (ሙ) ገንዘብ ሰነድ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል
- (ሠ) ገንዘብ ሰነድ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል

2 ለገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል

2.1 ገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል (50)

- ገንዘብ ሰነድ (35)
- ገንዘብ ሰነድ (05)
- ገንዘብ ሰነድ (05)
- ገንዘብ ሰነድ (05)

2.2 ገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል (15)

- ገንዘብ ሰነድ (10)
- ገንዘብ ሰነድ (5)

3 ገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል

3.1 03 ለገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል

ለገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል

- 60 በመቶ የገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል (20)
- 60 በመቶ የገንዘብ ሰነድ ላይ ያለውን ገንዘብ ለገንዘብ ቤቱ ለማግኘት ማግኘት ይገባል (10)

შედეგების დანერგვა მართვით, შედარებით, შედეგის გამოყვანის, არააგვის

შედეგების			
დეგა	შედეგების გამოყვანის	შედეგების დანერგვის	შედეგების გამოყვანის
			შედეგების
			შედეგების
			შედეგების
დეგა			

3. დანერგვის დანერგვის და შედეგების დასაბუთების (შედეგების გამოყვანის)

დეგა	შედეგების	შედეგების დანერგვის	შედეგების
			შედეგების გამოყვანის (დეგა)
			დეგა
			დეგა (დეგა)
			დეგა (დეგა)
			დეგა (დეგა)
			დეგა (დეგა)
			დეგა (დეგა)
			დეგა (დეგა)
დეგა			

سُورَةُ الْاٰنْكَارِ : اِسْمُ السُّورَةِ ، اِسْمُ الرَّسُوْلِ ، اِسْمُ مَلَكِ الْمَلٰٓئِكَةِ ، اِسْمُ الْمَلٰٓئِكَةِ ، اِسْمُ السَّجْدَةِ ، اِسْمُ الْاٰيٰتِ ، اِسْمُ الْاٰيٰتِ

4. اِسْمُ السُّورَةِ ، اِسْمُ الرَّسُوْلِ ، اِسْمُ مَلَكِ الْمَلٰٓئِكَةِ ، اِسْمُ الْمَلٰٓئِكَةِ ، اِسْمُ السَّجْدَةِ ، اِسْمُ الْاٰيٰتِ ، اِسْمُ الْاٰيٰتِ (مُرَادُ السُّورَةِ)

اِسْمُ السُّورَةِ	اِسْمُ الرَّسُوْلِ	اِسْمُ مَلَكِ الْمَلٰٓئِكَةِ	اِسْمُ الْمَلٰٓئِكَةِ	اِسْمُ السَّجْدَةِ	اِسْمُ الْاٰيٰتِ	اِسْمُ الْاٰيٰتِ
					اِسْمُ السُّورَةِ	01
					اِسْمُ السُّورَةِ	02
					اِسْمُ السُّورَةِ	03
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	04
					اِسْمُ السُّورَةِ	05
					اِسْمُ السُّورَةِ	06
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	07
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	08
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	09
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	10
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	11
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	12
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	13
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	14
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	15
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	16
					اِسْمُ السُّورَةِ	17
					اِسْمُ السُّورَةِ	18
					اِسْمُ السُّورَةِ	19
					اِسْمُ السُّورَةِ	20
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	21
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	22
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	23
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	24
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	25
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	26
					اِسْمُ السُّورَةِ (اِسْمُ السُّورَةِ)	27

سورتي ۲۷، سورتي ۲۸، سورتي ۲۹، سورتي ۳۰، سورتي ۳۱، سورتي ۳۲، سورتي ۳۳، سورتي ۳۴، سورتي ۳۵، سورتي ۳۶، سورتي ۳۷، سورتي ۳۸، سورتي ۳۹، سورتي ۴۰، سورتي ۴۱، سورتي ۴۲، سورتي ۴۳، سورتي ۴۴، سورتي ۴۵، سورتي ۴۶، سورتي ۴۷، سورتي ۴۸، سورتي ۴۹، سورتي ۵۰، سورتي ۵۱، سورتي ۵۲، سورتي ۵۳، سورتي ۵۴، سورتي ۵۵، سورتي ۵۶

سورتي	سورتي	سورتي	سورتي	سورتي
				سورتي ۲۸ (سورتي)
				سورتي ۲۹ (سورتي)
				سورتي ۳۰
				سورتي ۳۱
				سورتي ۳۲ (سورتي)
				سورتي ۳۳
				سورتي ۳۴
				سورتي ۳۵ (سورتي)
				سورتي ۳۶
				سورتي ۳۷
				سورتي ۳۸
				سورتي ۳۹ (سورتي)
				سورتي ۴۰ (سورتي)
				سورتي ۴۱ (سورتي)
				سورتي ۴۲ (سورتي)
				سورتي ۴۳
				سورتي ۴۴
				سورتي ۴۵
				سورتي ۴۶
				سورتي ۴۷ (سورتي)
				سورتي ۴۸ (سورتي)
				سورتي ۴۹
				سورتي ۵۰
				سورتي ۵۱
				سورتي ۵۲ (سورتي)
				سورتي ۵۳ (سورتي)
				سورتي ۵۴ (سورتي)
				سورتي ۵۵
				سورتي ۵۶

5. تۆۋەندىكى مەلۇماتلارنى تەكشۈرۈش (بىر تىلدا بىر تىلدا)

مۆھرىملىك دەرىجىسى	مۇستەھكەملىك	مۇددىتى	مۇددىتى			مۇددىتى	مۇددىتى
			مۇددىتى	مۇددىتى	مۇددىتى		
			<input checked="" type="checkbox"/>			<input checked="" type="checkbox"/>	300 نۇسخا
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>		01 نۇسخا
						<input checked="" type="checkbox"/>	01 نۇسخا
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>		100 نۇسخا
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>		300 نۇسخا
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>		100 نۇسخا
			<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>	05 نۇسخا
جەمئىي							

በስም ላይ ገብሮ



የግብርና ሚኒስቴር
የሥራ ልማት ማኅበር

የግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር - የግብርና ሚኒስቴር

1. የግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር

ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር
ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር

2. የግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር

ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር
ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር
ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር

3. የግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር

ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር
ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር
ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር	ግብርና ሚኒስቴር ለግብርና ሚኒስቴር

بىسەمى اللەھىم



چىرىشەنچى ۋە ۋەزىۋەت مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى
ۋە ۋەزىۋەت مەۆۇزى

مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى "مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى" ۋە ۋەزىۋەت مەۆۇزى
ۋە ۋەزىۋەت مەۆۇزى - مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى

1. مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى

	مەۆۇزى:	مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى (مەۆۇزى ۋە ۋەزىۋەت مەۆۇزى مەۆۇزى)
	مەۆۇزى: مەۆۇزى:	مەۆۇزى مەۆۇزى:

2. مەۆۇزى مەۆۇزى مەۆۇزى مەۆۇزى

	مەۆۇزى مەۆۇزى مەۆۇزى:	مەۆۇزى مەۆۇزى مەۆۇزى
	مەۆۇزى مەۆۇزى مەۆۇزى:	مەۆۇزى مەۆۇزى مەۆۇزى
	مەۆۇزى مەۆۇزى مەۆۇزى:	مەۆۇزى مەۆۇزى مەۆۇزى
مەۆۇزى مەۆۇزى مەۆۇزى مەۆۇزى:		مەۆۇزى مەۆۇزى مەۆۇزى مەۆۇزى:

3. مەۆۇزى مەۆۇزى مەۆۇزى

	مەۆۇزى مەۆۇزى مەۆۇزى:	مەۆۇزى مەۆۇزى مەۆۇزى
مەۆۇزى مەۆۇزى مەۆۇزى مەۆۇزى:		مەۆۇزى مەۆۇزى مەۆۇزى مەۆۇزى:
		مەۆۇزى مەۆۇزى مەۆۇزى مەۆۇزى:

הוראות להגשת תביעה, מעורבות, מעורבות, מעורבות

התביעה תוגש בתוך 6 חודשים מיום קבלת הודעת הירידה או הודעת סיום ההתקשרות.

התביעה תוגש בכתב ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה, כולל פרטים על המעורבות.

התביעה תוגש למשרד המשפטים או למשרד הכלכלה והתעשייה, בהתאם לתחום המעורבות.

התביעה תוגש על ידי המעורב או על ידי מי שהעניין חלף אליו, ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה.

התביעה תוגש על ידי המעורב או על ידי מי שהעניין חלף אליו, ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה.

התביעה תוגש על ידי המעורב או על ידי מי שהעניין חלף אליו, ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה.

התביעה תוגש על ידי המעורב או על ידי מי שהעניין חלף אליו, ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה.

התביעה תוגש על ידי המעורב או על ידי מי שהעניין חלף אליו, ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה.

התביעה תוגש על ידי המעורב או על ידי מי שהעניין חלף אליו, ויש להציג בה את כל הנתונים הרלוונטיים להגשתה.

16. נדרים ושבועות

א. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן.

ב. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן.

ג. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן.

17. נדרים ושבועות

א. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן.

18. נדרים ושבועות

א. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן. נדרים ושבועות הם מחויבות להגות בהנהגה, להקפיד על עשיית מצוות או על אי-עשייתן.

24. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

24. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

24. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

24. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

24. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

24. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**



25. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

25. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

26. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

26. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

26. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

27. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

27. **2019-2020** **2020-2021** **2021-2022** **2022-2023** **2023-2024** **2024-2025**

موردی در جدول نامزدی، مستخرج، موردی در جدول، از اسناد

کد	مردم	مردم	مردم
مردم			
مردم			
مردم			
مردم			
مردم			
مردم			
0.00			

مردم

کد	مردم	مردم	مردم
مردم			
مردم			
مردم			
مردم			
مردم			
0.00			

2. موردی در جدول نامزدی (مردم) موردی در جدول نامزدی:

کد	مردم	مردم	مردم
مردم			
مردم			

سۆزۈڭىزنىڭ دەۋرى، ئىشلىتىش ھۆكۈمى، سۆزۈڭىزنىڭ قىممىتى، ئىشلىتىش ھۆكۈمى، ئىشلىتىش ھۆكۈمى

سۆزۈڭىز	سۆزۈڭىزنىڭ قىممىتى	سۆزۈڭىزنىڭ ئىشلىتىش ھۆكۈمى	سۆزۈڭىزنىڭ دەۋرى	سۆزۈڭىزنىڭ ئىشلىتىش ھۆكۈمى
				01 كۆپلەش ھۆكۈمى
				02 كۆپلەش ھۆكۈمى
				03 ئىشلىتىش ھۆكۈمى
				04 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				05 ئىشلىتىش ھۆكۈمى
				06 ئىشلىتىش ھۆكۈمى
				07 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				08 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				09 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				10 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				11 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				12 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				13 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				14 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				15 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				16 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				17 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				18 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)
				19 ئىشلىتىش ھۆكۈمى (ئىشلىتىش)

سۆزۈڭىزنىڭ دەۋرى، ئىشلىتىش ھۆكۈمى، سۆزۈڭىزنىڭ قىممىتى، ئىشلىتىش ھۆكۈمى، ئىشلىتىش ھۆكۈمى

سۆزۈڭىزنىڭ دەۋرىدىكى ئىشلىرىڭىزنى، ئىشلىرىڭىزنىڭ نەتىجىسىنى، سۆزۈڭىزنىڭ قىممىتىنى، ئىشلىرىڭىزنىڭ نەتىجىسىنى

سۆزۈڭىزنىڭ دەۋرى	سۆزۈڭىزنىڭ نەتىجىسى	سۆزۈڭىزنىڭ نەتىجىسى	سۆزۈڭىزنىڭ نەتىجىسى	سۆزۈڭىزنىڭ نەتىجىسى
				20
				21
				22
				23
				24
				25
				26
				27
				28
				29
				30
				31
				32
				33
				34
				35
				36
				37
				38

سۆزۈڭىزنىڭ نەتىجىسى

سۆزۈڭىز	سۆزۈڭىزنىڭ قىممىتى	سۆزۈڭىزنىڭ ئىشلىتىش	سۆزۈڭىزنىڭ دېھقانچىلىقى	سۆزۈڭىزنىڭ ئىشلىتىش
				39 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				40 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				41 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				42 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				43 ئىشلىتىش ئىشلىتىش
				44 ئىشلىتىش ئىشلىتىش
				45 ئىشلىتىش ئىشلىتىش
				46 ئىشلىتىش ئىشلىتىش
				47 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				48 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				49 ئىشلىتىش ئىشلىتىش
				50 ئىشلىتىش ئىشلىتىش
				51 ئىشلىتىش ئىشلىتىش
				52 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				53 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				54 ئىشلىتىش ئىشلىتىش (سۆزۈڭىزنىڭ ئىشلىتىش)
				55 ئىشلىتىش ئىشلىتىش
				56 ئىشلىتىش ئىشلىتىش
				57 ئىشلىتىش ئىشلىتىش

سۆزۈڭىزنىڭ دېھقانچىلىقى

مۆھرىم ئۆزگەرتىش، مۆھرىملىك، مۆھرىملىك قىلغۇچى، ئۆزگەرتىش

مۆھرىملىك	مۆھرىملىك	مۆھرىملىك	مۆھرىملىك	مۆھرىملىك
			مۆھرىملىك (مۆھرىملىك، مۆھرىملىك، مۆھرىملىك، مۆھرىملىك)	58
			مۆھرىملىك	59
			مۆھرىملىك	60
			مۆھرىملىك	61
			مۆھرىملىك	62
			مۆھرىملىك	63
			مۆھرىملىك (500 مۆھرىملىك)	64
			مۆھرىملىك (500 مۆھرىملىك)	65
			مۆھرىملىك (500 مۆھرىملىك)	66
			مۆھرىملىك (1500 مۆھرىملىك)	67
			مۆھرىملىك (1500 مۆھرىملىك)	68
			مۆھرىملىك (1500 مۆھرىملىك)	69
			مۆھرىملىك (5 مۆھرىملىك)	70
			مۆھرىملىك (5 مۆھرىملىك)	71
			مۆھرىملىك (5 مۆھرىملىك)	72
			مۆھرىملىك (500 مۆھرىملىك)	73
			مۆھرىملىك (500 مۆھرىملىك)	74
			مۆھرىملىك (500 مۆھرىملىك)	75
			مۆھرىملىك (1500 مۆھرىملىك)	76

مۆھرىملىك

መደብ 5: የግብርና ስጦታ ስርዓት ለግብርና ስጦታ ስርዓት


ግብርና ስጦታ	ግብርና ስጦታ	ግብርና ስጦታ	ግብርና ስጦታ	ግብርና ስጦታ
			ግብርና ስጦታ (1500 ሺህ ስጦታ)	77
			ግብርና ስጦታ (1500 ሺህ ስጦታ)	78
			ግብርና ስጦታ (5 ሺህ ስጦታ)	79
			ግብርና ስጦታ (5 ሺህ ስጦታ)	80
			ግብርና ስጦታ (5 ሺህ ስጦታ)	81
0.00	ጠቅላላ			

5. የግብርና ስጦታ ስርዓት ለግብርና ስጦታ ስርዓት

ግብርና ስጦታ	ግብርና ስጦታ	ግብርና ስጦታ	ግብርና ስጦታ			ግብርና ስጦታ	ግብርና ስጦታ	
			ግብርና ስጦታ	ግብርና ስጦታ	ግብርና ስጦታ			
			<input checked="" type="checkbox"/>			<input checked="" type="checkbox"/>	300 ሺህ ስጦታ	ላይኛ
			<input checked="" type="checkbox"/>			<input checked="" type="checkbox"/>	01 ስጦታ	የግብርና ስጦታ
						<input checked="" type="checkbox"/>	01 ስጦታ	የግብርና ስጦታ
			<input checked="" type="checkbox"/>			<input checked="" type="checkbox"/>	100 ስጦታ	የግብርና ስጦታ
			<input checked="" type="checkbox"/>			<input checked="" type="checkbox"/>	300 ሺህ ስጦታ	የግብርና ስጦታ
			<input checked="" type="checkbox"/>			<input checked="" type="checkbox"/>	100 ስጦታ	የግብርና ስጦታ
			<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>	05 ስጦታ	የግብርና ስጦታ
0.00	ጠቅላላ							

3.2 ማረጋገጫ

- ማረጋገጫውን በትኩረት ማረጋገጥ፣ ማጠቃለያ፣ ማረጋገጥ፣ ማጠቃለያ፣ ማረጋገጥ፣ ማጠቃለያ



ገጽ 4

የሰነድ ስም ወይንም የሰነድ ዓይነት

(15 ዓመት ውስጥ) (አይደለም)

ሰነድ / ስም		1
1		1.1
የሰነድ ስም	የሰነድ ዓይነት	
የሰነድ ስም / የሰነድ ዓይነት	የሰነድ ስም / የሰነድ ዓይነት	
2		1.2
የሰነድ ስም	የሰነድ ዓይነት	
የሰነድ ስም / የሰነድ ዓይነት	የሰነድ ስም / የሰነድ ዓይነት	
2		2
1		2.1
የሰነድ ስም	የሰነድ ዓይነት	
የሰነድ ስም / የሰነድ ዓይነት	የሰነድ ስም / የሰነድ ዓይነት	
2		2.2
የሰነድ ስም	የሰነድ ዓይነት	
የሰነድ ስም / የሰነድ ዓይነት	የሰነድ ስም / የሰነድ ዓይነት	
3		3
የሰነድ ስም	የሰነድ ዓይነት	
የሰነድ ስም / የሰነድ ዓይነት	የሰነድ ስም / የሰነድ ዓይነት	

ገጽ 5

ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ

(34 ዓመት ለማሰባሰብ)

ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ (ገጽ 5)		1
ሥራ	ሥራ	1.1
ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	1.2
ሥራ	ሥራ	1.3
ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	1.4
ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	1.5
ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	1.6
ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	1.7
ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	ሥራ ለማሰባሰብ፣ ለመሥሪያ ቤቅ ለማሰባሰብ	1.8

6 වන කොටස

අධිකාරීන්ගේ සේවාවන් සඳහා වන කොටස

(34 වන කොටස)

1 වන කොටස (නිල සේවාවන් සඳහා)		1
1.1	සේවාව	සේවාව
1.2	සේවාව	සේවාව
1.3	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
1.4	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
1.5	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
1.6	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
1.7	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
2 වන කොටස (නිල සේවාවන් සඳහා)		2
2.1	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
2.2	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
2.3	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
2.4	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
2.5	3322112, 9790052	සේවාවන් සඳහා වන කොටස
2.6	සේවාවන් සඳහා වන කොටස	සේවාවන් සඳහා වන කොටස
2.7	@police.gov.mv procurement@police.gov.mv	සේවාවන් සඳහා වන කොටස

سَوَدِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ، سَوَدِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ، سَوَدِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ

سَوَدِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ

سَوَدِيَّ دَوَّوَرِيَّ دَوَّوَرِيَّ

سۆزگۈچى ۋە دېھقانچىلىق مەھسۇلاتى، مەھسۇلات سېتىش، مەھسۇلات چىقىرىش، تەكشۈرۈش، تەكشۈرۈش

P.O Number (Staff):

سۆزگۈچى مەھسۇلاتى

O Number (Arrest):

مەھسۇلات مەھسۇلاتى

دۆلەت قوشۇنلىرىدا مەھسۇلات چىقىرىش، تەكشۈرۈش، تەكشۈرۈش، تەكشۈرۈش

31		31 مەھسۇلات 2020		01 مەھسۇلات 2020		قوشۇمچە:		دۆلەت قوشۇنلىرىدا	
مەھسۇلات چىقىرىش، تەكشۈرۈش، تەكشۈرۈش، تەكشۈرۈش	مەھسۇلات چىقىرىش، تەكشۈرۈش، تەكشۈرۈش، تەكشۈرۈش	مەھسۇلات		مەھسۇلات		مەھسۇلات		مەھسۇلات	مەھسۇلات
		مەھسۇلات	مەھسۇلات	مەھسۇلات	مەھسۇلات	مەھسۇلات	مەھسۇلات		
								01 مەھسۇلات 2020	مەھسۇلات
								02 مەھسۇلات 2020	مەھسۇلات
								03 مەھسۇلات 2020	مەھسۇلات
								04 مەھسۇلات 2020	مەھسۇلات
								05 مەھسۇلات 2020	مەھسۇلات
								06 مەھسۇلات 2020	مەھسۇلات
								07 مەھسۇلات 2020	مەھسۇلات
								08 مەھسۇلات 2020	مەھسۇلات
								09 مەھسۇلات 2020	مەھسۇلات
								10 مەھسۇلات 2020	مەھسۇلات
								11 مەھسۇلات 2020	مەھسۇلات
								12 مەھسۇلات 2020	مەھسۇلات
								13 مەھسۇلات 2020	مەھسۇلات
								14 مەھسۇلات 2020	مەھسۇلات
								15 مەھسۇلات 2020	مەھسۇلات
								16 مەھسۇلات 2020	مەھسۇلات
								17 مەھسۇلات 2020	مەھسۇلات
								18 مەھسۇلات 2020	مەھسۇلات
								19 مەھسۇلات 2020	مەھسۇلات
								20 مەھسۇلات 2020	مەھسۇلات
								21 مەھسۇلات 2020	مەھسۇلات
								22 مەھسۇلات 2020	مەھسۇلات
								23 مەھسۇلات 2020	مەھسۇلات
								24 مەھسۇلات 2020	مەھسۇلات
								25 مەھسۇلات 2020	مەھسۇلات
								26 مەھسۇلات 2020	مەھسۇلات
								27 مەھسۇلات 2020	مەھسۇلات
								28 مەھسۇلات 2020	مەھسۇلات
								29 مەھسۇلات 2020	مەھسۇلات
								30 مەھسۇلات 2020	مەھسۇلات
								31 مەھسۇلات 2020	مەھسۇلات

2 ኃይሮገራ 7

ገንዘብ ማጠቃለያ ሪፖርት ለገንዘብ ማጠቃለያ ሪፖርት

(13ኛው ሪፖርት (ሰንጠረዥ 13))

2- ለገንዘብ ማጠቃለያ ሪፖርት (ገንዘብ ማጠቃለያ ሪፖርት)

ገንዘብ ማጠቃለያ ሪፖርት ለገንዘብ ማጠቃለያ ሪፖርት - ኃይሮገራ 2020										
ኃይሮገራ 02					ኃይሮገራ 01					
ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ
1										
2										
3										
4										
5										
6										
7										
8										
9										
10										
11										
12										
13										
14										
15										
16										
17										
18										
19										
20										

ገንዘብ

ገንዘብ ማጠቃለያ ሪፖርት	ገንዘብ ማጠቃለያ ሪፖርት	ገንዘብ ማጠቃለያ ሪፖርት	ገንዘብ ማጠቃለያ ሪፖርት